



MBJ-16070501022200 Seat No. _____

B. R. S. (Sem. II) (CBCS) (W.E.F. 2016) Examination

March / April – 2018

Horticulture & Forestry

(Principles of Horticulture) (Elective - 5) (New Course)

Time : **2** Hours]

[Total Marks : **50**

- | | |
|---|--|
| <p>૧ જામફળની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિનું વર્ણન કરો. ૧૦</p> <p style="text-align: center;">અથવા</p> <p>૧ પપૈયાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિનું વર્ણન કરો. ૧૦</p> <p>૨ નીચેના બે પ્રશ્નોમાં કોઈ પણ એક પ્રશ્નનો વિગતે ઉત્તર આપો : ૧૦</p> <p>(૧) ભિડાના પાકના અંગ્રેજી નામ, વૈજ્ઞાનિક નામ, જાતો, વાવેતર અંતર, ઉત્પાદન વગેરે માહિતી વિગતવાર આપો.</p> <p>(૨) મરચાના પાકના અંગ્રેજી નામ, વૈજ્ઞાનિક નામ, જાતો, વાવેતર અંતર, ઉત્પાદન વગેરે માહિતી વિગતવાર આપો.</p> <p>૩ નીચેની પાંચ ટૂંકનોંધમાંથી કોઈ પણ ગ્રાન્ટ ટૂંકનોંધ લખો : ૧૫</p> <p>(૧) ફળવાડી આયોજનમાં હવામાનનું મહત્વ</p> <p>(૨) દાડમની જાતો અને લાક્ષણિકતા</p> <p>(૩) લસણા</p> <p>(૪) ફોસ્ફરસની ઊંઘાપના ચિહ્નો</p> <p>(૫) કલમ પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ.</p> <p>૪ નીચેના સાત પ્રશ્નોમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નોના માંયાં મુજબ જવાબ આપો : ૧૫</p> <p>(૧) વનસ્પતિના આવશ્યક ગૌણ પોષક તત્ત્વોના નામ જણાવો.</p> <p>(૨) ચીકુની જાતોના નામ જણાવો.</p> <p>(૩) નાઈટ્રોજન તત્ત્વ ધરાવતા ગ્રાન્ટ ખાતરના નામ જણાવો.</p> <p>(૪) કલમ રોપતી વખતે ધ્યાન રાખવાની બાબતો જણાવો.</p> <p>(૫) D.A.P.માં ક્યા તત્ત્વો આવેલા હોય છે ? અને કેટલા ટકા તે જણાવો.</p> <p>(૬) રીંગણાનું અંગ્રેજી તથા વૈજ્ઞાનિક નામ જણાવો.</p> <p>(૭) નાળિયેરનું અંગ્રેજી તથા વૈજ્ઞાનિક નામ જણાવો.</p> | <p>૧૦</p> <p>૧૦</p> <p>૧૦</p> <p>૧૫</p> <p>૧૫</p> |
|---|--|